

B.Com. Semester - 6 (CBCS) Examination
July-2025 (OLD COURSE)
CORPORATE TAX PLANNING -2(DSE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ કામદારોનાં મહેનતાણાનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો. (૨૦)
 અથવા
 પ્રશ્ન-૧ લિક્વિડેશનનાં સમયે મિલકતોનાં વિતરણનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો.
 પ્રશ્ન-૨ વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૨૦)
 અથવા
 પ્રશ્ન-૨ વીમા વળતરની રીસીપ્ટ સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો.
 પ્રશ્ન-૩ ફેરબદલી કિંમત નિર્ધારણ નિયમન જોગવાઈ વિશે સમજાવો. (૧૫)
 અથવા
 પ્રશ્ન-૩ સમજાવો:
 (૧) એડવાન્સ પ્રાઈસીંગ એગ્રીમેન્ટ (૦૮)
 (૨) ડબલ ટેક્સેશન રિલિફ (૦૭)
 પ્રશ્ન-૪ શાસક અને ગૌણ કંપનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો. (૧૫)
 અથવા
 પ્રશ્ન-૪ સંયોજનના સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો.

ENGLISH VERSION

- Que-1 Explain Corporate Tax planning with reference to Employees Remuneration with Example. (20)
 OR
 Que-1 Explain Corporate Tax planning with reference to distribution of assets at the time of Liquidation with Example.
 Que-2 Explain Corporate Tax planning with reference to sale of Scientific research assets with Example. (20)
 OR
 Que-2 Explain Corporate Tax planning with reference to Receipt of Insurance compensation with Example.
 Que-3 Explain about provisions regulating Transfer Pricing. (15)
 OR
 Que-3 Explain:
 (1) Advance Pricing Agreement (08)
 (2) Double Taxation Relief (07)
 Que-4 Explain about Transfer of assets between holding and subsidiary Companies (15)
 OR
 Que-4 Explain Corporate Tax planning with reference of Amalgamation.
